

એમ્બ્રોડરીના કારખાનામાંથી એમ્બ્રોડરી મશીનના ડીવાઇસ તથા માસ્ટર કાર્ડની ચોરી કરતી ટોળકીને
ઝડપી પાડતી, કાપોદ્રા પોલીસ.

સુરત શહેરના કાપોદ્રા પો.સ્ટે. વિસ્તારમાં વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના કામે પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. રાજેન્દ્રસિંહ રાયમલભાઇ બ.નં.૨૮૧ તથા અ.પો.કો. પૃથ્વીરાજસિંહ રવજીભાઇ બ.નં.૨૧૬૭ નાઓને ખાનગી રહે મળેલ બાતમી આધારે આરોપી (૧) ગોવીંદ ઉર્ફે પંડીત વિજયકુમાર ગૌડ ઉ.વ.૩૦ ધંધો. એમ્બ્રોડરી મજૂરી રહે. મ.નં. ૩૮, ખડી મહેલ્લો, ફુલપાડા ગામ નવી જી.આઇ.ડી.સી.ની પાછળ કતારગામ, સુરત મુળવતન ગામ ચકવર તા.કુંડા જી.પ્રતાપગઢ (૨) રાજેશ સંતોષ સાહુ ઉ.વ.૨૦ ધંધો.એમ્બ્રોડરી મશીન રહે. ત્રીજા માળે શેરી નં.૩, સ્વામીનારાયણ મંદિર પાસે ઘનશ્યામનગર એલ.એચ.રોડ, વરાછા, સુરત. મુળવતન ગામ બેન્દા જી. તૈદવારી જી.બાંદા યુ.પી (૩) વિજયપ્રતાપ સ્વામીનાથ વર્મા ઉ.વ.૨૦ ધંધો. એમ્બ્રોડરી મશીન ચલાવવાનું રહે. ત્રીજા માળે શેરી નં. ૩, સ્વામીનારાયણ મંદિર પાસે, ઘનશ્યામનગર, એલ.એચ.રોડ, વરાછા, સુરત. મુળવતન બરહરકલા તા.હરૈયા જી.બસ્તિર યુ.પી. (૪) મનોજ ગુલાબ કોલી ઉ.વ.૨૪ ધંધો. ડ્રાઇવીંગ રહે.૮, શ્રીનાથજી સોસાયટી, રૂક્મણી સોસાયટીની સામે, કારગીલ ચોક, પુણાગામ, સુરત. મુળવતન વિદગાવ તા.જી.જલગાંવ મહારાષ્ટ્ર (૫) નીકુંજભાઇ નાગજીભાઇ ધામેલીયા ઉ.વ.૨૨ ધંધો. વેપાર રહે. સી/૨૦૨, સીટી પોઇન્ટ મનજીભાઇના મકાનમાં લજામણી ચોક મોટાવરાછા, સુરત મુળવતન વાળુકડ તા. પાલીતાણા જી. ભાવનગર વાળાનાઓને ઝડપી પાડી, સદરહું આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-૩ કી.રૂ. ૧૧,૦૦૦ તથા એમ્બ્રોડરી ડીવાઇસ નંગ-૨૨ કી.રૂ. ૧,૩૨,૦૦૦/- તથા માસ્ટર કાર્ડ નંગ-૨ કી.રૂ. ૧૨,૦૦૦/- તથા એક લોડીંગ રીક્ષા કી.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૫૫,૦૦૦/- ની મતાનો મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓને અટક કરી નીચે મુજબના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

(૧) કાપોદ્રા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૫૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ડીટેક્ટ થયેલ છે.(૨)કતારગામ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ડીટેક્ટ થયેલ છે.

આરોપીઓની એમ.ઓ.-સદરહું આરોપીઓને પકડી તેની પુછપરછ કરતા સદરહું આરોપીઓ બંધ એમ્બ્રોડરીના ખાતાની રેકી કરી તે ખાતાને ટાર્ગેટ કરી, રાત્રીના સમયે ખાતાના દરવાજાના નકુચા આરીથી તોડી એમ્બ્રોડરી મશીનમાં લગાવેલ ડીવાઇસ તથા માસ્ટર કાર્ડ એલએનકી પાનાથી ખોલી, ચોરી કરી, સહ આરોપી નીકુંજ ધામેલીયાનાઓને વેચી દેતા હોવાની હકીકત જણાય આવેલ છે.